

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ

મ્યુ. સેક્રેટરી ઓફિસ



**PRO ACTIVE DISCLOSURE OF
AHMEDABAD MUNICIPAL CORPORATION'S
MUNICIPAL SECRETARY OFFICE**

**U/S 4 (1) OF
THE RIGHT TO INFORMATION ACT – 2005**

(Update as on 1st May 2022)

Price : Rs.25/-

અનુક્રમણિકા

ક્રમ	વિગત	પેજ નં
૧.	પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો	૧ થી ૪
૨.	પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો	૫
૩.	દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી	૬ થી ૭
૪.	પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો	૮
૫.	પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો/ વિનિયમો/ સુચનાઓ/ નિયમસંગ્રહો અને રેકર્ડ	૯
૬.	પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક	૧૦
૭.	તેની નિતી અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજૂઆત માટેની વિધમાન કઈ ગોઠવણની વિગતો	૧૧ થી ૧૨
૮.	તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ ?	૧૩ થી ૧૪
૯.	તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા	૧૫ થી ૧૬
૧૦.	તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પધ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર.	૧૭
૧૧.	તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ વહેંચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજન્સી ફાળવેલ અંદાજપત્ર	૧૮
૧૨.	ફાળવેલ રકમો અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત	અત્રેના ખાતાને લાગુ પડતુ નથી
૧૩.	તેણે આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો	અત્રેના ખાતાને લાગુ પડતુ નથી
૧૪.	ઈલેક્ટ્રોનિક સ્વરુપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહિતીને લગતી વિગતો	૧૯
૧૫.	જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.	૨૦
૧૬.	જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો	૨૧
૧૭.	ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી	૨૨ થી ૨૯

પ્રકરણ-૧ (નિયમ સંગ્રહ-૨)

પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો

વિભાગ/ વ્યવસ્થાતંત્ર	કાર્યો અને ફરજોની વિગતો
મ્યુનિ. બોર્ડ વિભાગ	<ol style="list-style-type: none"> ૧. અ.મ્યુ.કોર્પો.ની મિટીંગ માટેના એજન્ડા,નોટીસ માટે સ્ટે.કમિટી, ટ્રાન્સપોર્ટ કમિટી, સ્પે. કમિટીઓ, સભ્યશ્રીઓ તરફથી પુછાયેલા સવાલો, દરખાસ્તો વિગેરે ઉપરથી નોટીસ મેટર તૈયાર કરવી, એજન્ડા તૈયાર કરવાની તમામ કામગીરી કરવી. ૨. નોટીસ મેટર જુદા જુદા વર્તમાનપત્રોમાં ક્રમાનુસાર આપવી. ૩. અ.મ્યુ.કોર્પો.ના એજન્ડા નોટીસ સભ્યશ્રીઓને સ્પીડ પોસ્ટથી મોકલવા, તેમજ એજન્ડા ખાતાઓમાં વહેંચવા, એજન્ડા ફાઇલો તૈયાર કરાવી બોર્ડ મીટીંગ સમયે સભ્યશ્રીઓના ટેબલ ઉપર મુકવી. એજન્ડા ઇ-મેઇલ કરવા. ૪. મ્યુ. બોર્ડની મિટીંગોમાં હાજર સભ્યોની હાજરી લેવી, રજીસ્ટરમાં હાજરી ખતવવી, માસાંતે સદર હાજરી મીટીંગ એલાઉન્સ માટે આપવી. ૫. બોર્ડની મિટીંગોમાં હાજર રહી નિકાલ થયેલા કામોની નોંધ રાખવી, મ્યુ. બોર્ડમાં આવતા કામોના ઠરાવો તૈયાર કરી સંકલન ખાતે મોકલવા. ૬. અ.મ્યુ.કોર્પો.ની મિટીંગોની કાર્યવાહીની કાર્યનોંધ રાખવી, સાંકળીયા (ત્રિમાસીક રેકર્ડ) તૈયાર કરાવવા, સાંકળીયા મ્યુ.કાઉન્સિલરશ્રીઓ તથા ખાતાના અધિકારીશ્રીઓને ઇ-મેઇલ કરવા. ૭. વાર્ષિક વહીવટી અહેવાલ અંગેની માહિતી એકત્ર કરી મ્યુ. સેક્રેટરી ઓફીસનો વહીવટી અહેવાલ તૈયાર કરવો. ૮. જુના રેફરન્સો શોધવા તેમજ મ્યુ. સેક્રેટરીશ્રી તરફથી વખતોવખત સુચવેલ કામગીરી કરવી.
સ્ટે.કમિટી વિભાગ	<ol style="list-style-type: none"> ૧. મ્યુ.કોર્પો.ના જુદા જુદા ખાતાઓ તથા ખાસ સમિતિઓ તરફથી સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી / નિર્ણય માટે મુકવામાં આવતા કામો સ્વીકારવા. ૨. કામોની ચકાસણી કરી પ્રેસી તૈયાર કરી સક્ષમ અધિકારીની મંજૂરી મળ્યેથી એજન્ડા તૈયાર કરવો. ૩. એજન્ડા તૈયાર થયેથી સંબંધીત હોદ્દદારશ્રીઓ, સ્ટે.કમિટીના સભ્યશ્રીઓ, તથા મ્યુ. કોર્પો.ના સંબંધીત ખાતાઓમાં પહોંચાડવા / ઇ-મેઇલ કરવા. ૪. સ્ટે.કમિટીમાં રજુ કરવાના તાકીદના કામો તેમજ સભ્યશ્રીઓની દરખાસ્તો તૈયાર કરવી. ૫. સ્ટે.કમિટીની મિટીંગમાં રજુ થયેલ કામો અંગે થતા નિર્ણય અનુસાર ઠરાવો તૈયાર કરી નકલ સંકલન વિભાગમાં મોકલવી તથા કમિટીનું પ્રોસીડીંગ તૈયાર કરવું. ૬. સ્ટે.કમિટીમાં થયેલ ઠરાવોનો રેકર્ડ રાખવો. હોદ્દદારશ્રીઓ, અધિકારીશ્રીઓ દ્વારા માંગવામાં આવતા મહત્વના ઠરાવોના રેફરન્સ શોધવા. ૭. દફતરેની ફાઇલોનું ફેરીસ્ટ તૈયાર કરવું. ૮. મ્યુ.કોર્પો.ના રેકર્ડ ખાતાના ક્લાર્કને અરજદારશ્રીઓની માંગણી અનુસાર ઠરાવોની નકલો તૈયાર કરાવી કમ્પેરીંગ કરાવી પૂરી પાડવી. ૯. આ ઉપરાંત સ્ટે.કમિટીની સબ કમિટીઓ જેવી કે અપીલ સબ કમિટી તથા ઓડીટ અહેવાલ સબ કમિટીની ઉપરોક્ત દર્શાવ્યા અનુસારની તમામ કાર્યવાહી. ૧૦. માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી તથા મ્યુ. સેક્રેટરીશ્રી તરફથી વખતો વખત સુચવેલ કામગીરી કરવી.

<p>જુદી જુદી ખાસ સમિતિઓની કામગીરી</p>	<ol style="list-style-type: none"> ૧. મ્યુ.કોર્પો.ના જુદા જુદા ખાતાઓ તરફથી ખાસ સમિતિઓની મંજૂરી / નિર્ણય માટે આવતા કામોની ફાઇલો સ્વીકારવી. ૨. આવેલ કામોની ચકાસણી કરી પ્રેસી તૈયાર કરી સંબંધિત કમિટીના ચેરમેનશ્રીની સુચના અનુસાર એજન્ડા બહાર પાડી સમિતિના સભ્યશ્રીઓને તથા જુદા જુદા ખાતાઓમાં એજન્ડા પહોંચાડવો / ઈ-મેઇલ કરવા. ૩. ખાસ સમિતિઓની મિટીંગમાં રજુ થયેલ કામો અંગે થતા નિર્ણય અનુસાર ઠરાવો તૈયાર કરી નકલ સંકલન વિભાગમાં મોકલી આપવી તથા પ્રોસીડીંગ તૈયાર કરવું. ૪. આ ઉપરાંત દર ત્રણ મહિને કમિટીનું પ્રોસીડીંગ મ્યુ. બોર્ડમાં મંજૂર કરાવવા માટે તૈયાર કરી મોકલવાની કામગીરી કરવી. ૫. દફતરેની ફાઇલોનું ફેરીસ્ટ તૈયાર કરવું. ૬. ચેરમેનશ્રી/ડે.ચેરમેનશ્રીની આવતી ટપાલોને તેમજ નાગરિકો તરફથી આવતી અરજીઓ ઈન્વર્ડ કરી સંબંધિત ચેરમેનશ્રી સમક્ષ મુકી ચેરમેનશ્રીનો શેરો કરાવી જે તે ખાતે મોકલવી. ૭. સંબંધિત ચેરમેનશ્રીની સૂચના અનુસાર જે તે કમિટીના રાઉન્ડ ગોઠવવામાં આવે તેના સરક્યુલર ની વ્યવસ્થા કરવી. ૮. નોન કોરમ રહેલ મીટીંગ માટે નવેસરની તારીખ નક્કી કરાવી સરક્યુલરો કરવા તથા કમિટીના સભ્યોને સરક્યુલર પહોંચાડવા. ૯. કમિટીના સભ્યશ્રીઓના ઓનેરેરીયમ માટેની હાજરીની વિગત સંબંધિત કલાર્કને આપવી. ૧૦. નાગરિકો તરફથી જુદા-જુદા ઠરાવોની નકલ સેન્ટ્રલ રેકર્ડ ખાતા મારફતે માંગણી થાય છે ત્યારે રેકર્ડ કલાર્કની માંગણી અનુસાર રેકર્ડ કાઢી આપી અને માંગણી મુજબના ઠરાવો કમ્પેર કરી તે અંગે આનુષંગિક કાર્યવાહી કરવી. ૧૧. બોર્ડ વિભાગ તરફથી માંગવામાં આવતી કમિટીમાં સભ્યોની હાજરીની વિગતો આપવી. ૧૨. તેમજ મ્યુ. સેક્રેટરીશ્રી વખતોવખત સુચવેલ કામગીરી કરવી.
<p>માન. મેયરશ્રીનું કાર્યાલય</p>	<ol style="list-style-type: none"> ૧. માન. મેયરશ્રી પર નાગરિક લક્ષી ફરીયાદો - પ્રશ્નો અંગે આવતી લેખિત અરજીઓ તથા ટપાલો અંગે માન. મેયરશ્રીની સુચના અનુસાર જરૂરી ફોલોઅપ સાથે નિકાલ કરવા સંબંધિત વિભાગોને મોકલવી. ૨. મ્યુનિસિપલ કમિશનરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રજાલક્ષી કામો અંગે સમય સમય પર અને સમયમર્યાદામાં કરવાના થતા જરૂરી પત્રવ્યવહારની કામગીરી કરવી. ૩. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશ્નો બાબતમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સાથે ગુજરાતી/અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરવા. ૪. મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ ઉપરાંત મ્યુનિ. કમિશનરશ્રી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે માન. મેયરશ્રીની મિટીંગોનું આયોજન કરવું ૫. જુદા જુદા ઉદ્ઘાટન-લોકાર્પણ-ભૂમિપૂજનના કાર્યક્રમોના આયોજન તેમજ મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાંજલી કરવા અંગેના પત્રવ્યવહાર / પરિપત્રો કરવા. ૬. માન. મેયરશ્રીની રૂબરૂ મુલાકાતે આવતા નાગરિકો તથા મહાનુભાવોના પ્રશ્નો/ફરીયાદોનો જરૂરી ફોલોઅપ સાથે નિકાલ કરવો.

	<p>૭. દેશ-પરદેશથી આવતા મહાનુભાવો/મહેમાનોના સ્વાગત તેમજ તેઓ સાથેની મિટીંગોનું આયોજન કરવું.</p> <p>૮. માન. મેયરશ્રીના કાર્યક્રમો અંગેની ડાયરી મેઈન્ટેઈન કરવી.</p> <p>૯. જુદા જુદા કાર્યક્રમો અંગેના મેયરશ્રીના પ્રવચનો/સુચના મુજબ પ્રેસનોટ તૈયાર કરવી.</p> <p>૧૦. મેયરશ્રીની ઓફીસમાં આવતા ફોન એટેન્ડ કરવા તથા જે તે સુચના અંગે જરૂરી ફોલોઅપ કરવું.</p> <p>૧૧. મેયર ઓફીસને લગતી અન્ય તમામ કામગીરી કરવી.</p> <p>૧૨. મ્યુનિસિપલ બોર્ડ મિટીંગની મિનીટ્સ તૈયાર કરવી.</p>
ડેપ્યુટી મેયરશ્રીનું કાર્યાલય	<p>મ્યુ. સેક્રેટરી ઓફીસમાં માન. ડે.મેયરશ્રીના કાર્યાલયમાં સીનીયર ક્લાર્કની ઓફીસ કામગીરી</p> <p>૧. માન. ડે.મેયરશ્રી ની અંગત મદદનીશની કામગીરી જેવી કે તેમના કાર્યક્રમો વિગેરેની નોંધ કરી ડાયરી તૈયાર કરવી.</p> <p>૨. માન. ડે.મેયરશ્રીની સુચના અનુસાર પત્ર વ્યવહાર તૈયાર કરાવવાની, આઉટવર્ડ રજીસ્ટરમાં નોંધી જે તે ખાતે મોકલવાની તથા ઓફીસ કોપી ફાઈલીંગ કરવાની કામગીરી.</p> <p>૩. માન. ડે.મેયરશ્રી દ્વારા યોજવામાં આવતી પત્રકાર પરિષદ, મ્યુ. અધિકારીશ્રીઓ તથા મ્યુ. કાઉન્સિલરશ્રીઓ સાથે યોજવામાં આવતી મિટીંગોના આયોજન અંગેની વ્યવસ્થા કરવી જેવી કે સરક્યુલર બહાર પાડવા તેમજ તેને આનુષંગિક કાર્યવાહી કરવી.</p> <p>૪. ડે.મેયરશ્રી દ્વારા વખતોવખત સોંપવામાં આવતી કામગીરી.</p>
ચેરમેનશ્રી સ્ટેન્ડીંગ કમિટીનું કાર્યાલય	<p>મ્યુ. સેક્રેટરી ઓફીસમાં માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટીના કાર્યાલયની કામગીરી</p> <p>૧. માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટીની અંગત મદદનીશની કામગીરી જેવી કે તેમના કાર્યક્રમો વિગેરેની નોંધ કરી ડાયરી તૈયાર કરવી.</p> <p>૨. માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી દ્વારા થતા પત્ર વ્યવહાર તૈયાર કરાવવાની, આઉટવર્ડ રજીસ્ટરમાં નોંધવાની જે તે ખાતે મોકલવાની તથા ઓફીસ કોપી ફાઈલીંગ કરવાની કામગીરી.</p> <p>૩. માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી દ્વારા યોજવામાં આવતી પત્રકાર પરિષદ, મ્યુ. અધિકારીશ્રીઓ તથા મ્યુ. કાઉન્સિલરશ્રીઓ સાથે યોજવામાં આવતી મિટીંગોની જાણ કરવાની તેમજ મિટીંગનું આયોજન કરવું.</p> <p>૪. સ્ટે.કમિટીમાં મંજૂર થયેલ કામો અને મ્યુ.કોર્પો.ની સામાન્ય સભાની ફાઈલો તૈયાર કરીને ચેરમેનશ્રી સમક્ષ રજુ કરવાની.</p> <p>૫. મ્યુ. સેક્રેટરી ઓફીસ દ્વારા તથા માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી દ્વારા વખતો વખત જે કામગીરી સોંપવામાં આવે તેનો અમલ કરવાની.</p>
વહીવટી વિભાગ	<p>૧. મ્યુ. સેક્રેટરી ખાતામાં ફરજ બજાવતાં તમામ અધિકારીઓ /કર્મચારીઓને લગતી વહીવટી કામગીરી જેવી કે પગાર, તમામ પ્રકારની રજાઓ, સર્વિસ બુક નિભાવવાની ઈન્ડીમેન્ટ, નિવૃત્ત થયેલ કર્મચારીઓના નિવૃત્તિના લાભો અંગેની કામગીરી.</p> <p>૨. ખાતાની ટપાલ વહેંચણી અંગે ઈન્વર્ડ - આઉટવર્ડની કામગીરી.</p> <p>૩. મ્યુ. સેક્રેટરીશ્રીની જુદી જુદી મેળવેલ મંજૂરીઓના ઠરાવોનું રજીસ્ટર, ટેલીફોન રજીસ્ટર, બાર એડવાન્સ રજીસ્ટર વિગેરેના રજીસ્ટરો નિભાવવાની કામગીરી.</p>

	<p>૪. હોદ્દેદારશ્રીઓને ફાળવેલ મોટરકારોનું સંચાલન તથા મરામત અને નિભાવવાની કામગીરી.</p> <p>૫. કન્ટીજન્સી મેળવવા ઈન્ડેન્ટ, તથા ખાતાના બજેટ અંગેની કામગીરી</p> <p>૬. પગારબીલો સિવાયના અન્ય બિલો મ્યુ. કાઉન્સીલરશ્રીઓના ઓનેરેરીયમ, મેડીકલ બિલ, ટેલેફોન બિલ મોબાઇલ બીલ તથા અન્ય જરૂરીયાત મુજબની ખરીદી અંગે મંજૂરી મેળવી તેના બિલો બનાવવાની કામગીરી</p> <p>૭. મ્યુ. કોર્પો.ના સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી તથા જરૂર જણાય તો બહારથી સ્ટેશનરી ની ખરીદી કરી જરૂરીયાત મુજબ ખાતાના વિવિધ વિભાગોમાં વહેંચણીની કામગીરી.</p> <p>૮. ઈમ્પ્રેશ કેશના બિલો વટાવી કેશ લાવવી.</p> <p>૯. નિમંત્રણો, સરક્યુલરો વગેરે ખાતાના પટાવાળાઓ મારફતે મ્યુ. કાઉન્સીલરશ્રીઓને પહોંચાડવા.</p> <p>૧૦. મ્યુ. સેક્રેટરી ઓફીસ ખાતે આવેલ હોદ્દેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ, ડે.ચેરમેનશ્રીઓ તથા પક્ષના કાર્યાલયોમાં તેઓની સુચના અનુસારની કામગીરી/ફરજો બજાવવા સારુ પટાવાળા સહિત વર્ગ-૪ના કર્મચારીઓની વ્યવસ્થા કરવાની કામગીરી</p> <p>૧૧. ચૂંટાયેલા હોદ્દેદારશ્રીઓ/માન.મેયરશ્રી/ડે.મેયરશ્રી/ચેરમેનશ્રી સ્ટે.કમિટી/નેતાશ્રી/મ્યુ.સેક્રેટરીશ્રી તરફથી વખતોવખત સુચવવામાં આવતી કામગીરી</p>
--	---

પ્રકરણ-૨ (નિયમ સંગ્રહ-૨) પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

ધી ગુજરાત મ્યુ. કોર્પો. એક્ટ -૧૯૪૯ ની કલમ નં. ૪૮ મુજબ મ્યુ. સેક્રેટરી ઓફિસે વિવિધ ફરજો બજાવવાની હોય છે. જેમાં કોર્પો.ની મિટીંગ સહિત સ્થાયી સમિતિ અને જી. પી. એમ. સી. એક્ટ અનુસાર આવેલ ખાસ સમિતિઓનાં સંચાલનની કામગીરી મ્યુ. સેક્રેટરી ઓફિસ દ્વારા કરાય છે, જેમાં વહીવટી તંત્ર દ્વારા રજુ થયેલ દરખાસ્તોને જે તે કમિટી સમક્ષ રજુ કરી તેના અનુસંધાને મિટીંગમાં થતાં નિર્ણય અનુસાર ઠરાવો તૈયાર કરી તેને જરૂરી કાર્યવાહી સાડુ વહીવટી તંત્ર તરફ પાઠવી આપવાની કામગીરી મ્યુ. સેક્રેટરી ઓફિસ મારફતે થાય છે. સદર કામગીરી ઉપરાંત ઉચ્ચહોદ્દારશ્રીઓ જેવા કે મેયરશ્રી, ડે. મેયરશ્રી, સ્ટે. કમિટી ચેરમેનશ્રી સહિત અન્ય હોદ્દેદારશ્રીઓની કામગીરી તેઓશ્રીની સુચના અનુસાર બજાવવાની થાય છે.

પ્રકરણ-૩

દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી

૩.૧	જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્યપદ્ધતિ અનુસારવામાં આવે છે? (સચિવાલય નિયમ સંગ્રહ અને કામકાજના નિયમોના નિયમ સંગ્રહ અન્ય નિયમો/વિનિયમો વિગેરેનો સંદર્ભ ટાંકી શકાય)	:	જુદા-જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે નિયમો અનુસાર જુદી-જુદી ખાસ સમિતિઓ, સ્થાયી સમિતિ તથા કોર્પોરેશન વિગેરેની બેઠક બોલાવવી બહુમતિએ નિર્ણય લેવા માટે કોર્પોરેશનની સ્થાયી સમિતિ પરિવહન સમિતિ, તથા ખાસ સમિતિઓની કાર્યવાહીનું સંચાલન કરવાના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
૩.૨	અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતિઓ / ઠરાવેલી કાર્યપદ્ધતિઓ / નિયત માપદંડો / નિયમો ક્યાં ક્યાં છે? નિર્ણય લેવા માટે ક્યાં ક્યાં સ્તરે વિચાર કરવામાં આવે છે?		અગત્યની બાબતો માટે ખાસ નિર્ણય લેવા માટે પ્રથમ કમિશનરશ્રી લેવલેથી કાર્ય અંગેની દરખાસ્ત આવ્યેથી તે બાબતે નિર્ણય લેવા માટે પરિપત્ર (એજન્ડા) બહાર પાડી બેઠક (મીટીંગ) બોલાવવામાં આવે છે. જેમાં કોર્પોરેશનની સ્થાયી સમિતિ, પરિવહન સમિતિ તથા ખાસ સમિતિઓની કાર્યવાહીનું સંચાલન કરવાના નિયમો તથા ધી જી.પી.એમ.સી. એક્ટ અન્વયે જુદી જુદી કમિટીઓના સત્તા અંગેના નિયમો મુજબ તથા ધી જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈઓ અનુસાર સ્થાયી સમિતિની બેઠકમાં તથા કોર્પોરેશનની બેઠકમાં ધી જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈઓ મુજબ બેઠક બોલાવી નિર્ણયો કરવામાં આવે છે. આમ ખાસ સમિતિઓ ત્યારબાદ સ્થાયી સમિતિ ત્યારબાદ કોર્પોરેશન સ્તરે વિચારણા કરવામાં આવે છે.
૩.૩	નિર્ણયને જનતા સુધી પહોંચાડવા કઈ વ્યવસ્થા છે ?		વર્તમાનપત્રો, ઈલેક્ટ્રોનિક્સ મીડીયા.
૩.૪	નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેના મંતવ્યો લેવાનાર છે. તે અધિકારી ક્યા છે ?		નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિષય સંલગ્ન ખાતાધિકારી, કમિશનરશ્રી
૩.૫	નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે?		ધી જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ મુજબ કોર્પોરેશને રચેલ ખાસ સમિતિઓ, સ્થાયી સમિતિ, કોર્પોરેશન (બોર્ડ) જે તે લેવલે નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી છે.

૩.૬	જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. તેની માહિતી અલગ રીતે નીચેના નમુનામાં આપો.
ક્રમ નંબર	ઠરાવ આંક
જેના ઉપર નિર્ણય લેવાનાર છે તે વિષય	જે તે વિષય સંબંધી રજુ થનાર દરખાસ્ત
માર્ગદર્શન સુચના/દિશા નિર્દેશ જો કોઈ હોય તો	દરખાસ્તમાં જણાવેલ મંતવ્યો/અભિપ્રાય
અમલની પ્રક્રિયા	નિર્ણય થયે પસાર થયેલ ઠરાવ અનુસાર
નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓના હોદ્દા	મ્યુ. કમિશનરશ્રી તથા સંલગ્ન ખાતાના અધિકારીશ્રી
ઉપર જણાવેલ અધિકારીઓનાં સંપર્ક અંગેની માહિતી	અમદાવાદ મહાનગરપાલિકા, મુખ્ય કચેરી ઓફીસ. સરાદાર પટેલ ભવન દાણાપીઠ, અમદાવાદ-૧.
જો નિર્ણયથી સંતોષ ન હોય તો ક્યાં અને કેવી રીતે અપીલ કરવી	ધી જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈઓ અનુસાર

પ્રકરણ-૪

પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો

હોદ્દો : મ્યુ. સેક્રેટરી

મ્યુનિસિપલ સેક્રેટરીની સત્તા અને ફરજો

૪૮. મ્યુનિસિપલ સેક્રેટરી કોર્પોરેશનના તેમજ સ્થાયી સમિતિના પણ સેક્રેટરી રહેશે અને તેમણે -
- (ક) આ અધિનિયમ થી અથવા તે મુજબ તેમને બજાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો હોય તેવી ફરજો મ્યુ. કોર્પોરેશન અને સ્થાયી સમિતિ અનુક્રમે પોત પોતાના સંબંધી તેને ફરમાવે તેવી બીજી ફરજો બજાવવી.
- (ખ) (૧) કોર્પોરેશન અને કલમ-૩૦ અથવા ૩૧ મુજબ કોર્પોરેશને નીમેલી કોઈપણ સમિતિની,
(૨) સ્થાયી સમિતિ અને તેની કોઈપણ પેટા સમિતિની કાર્યવાહીઓ સાથે સંબંધ ધરાવતા સઘળા કાગળો અને દસ્તાવેજો કસ્ટડીમાં રાખવા.
- (ગ) સ્થાયી સમિતી વખતો વખત કરે તેવા નિર્દેશનોને આધિન રહીને તેના સીધા તાબા હેઠળના અધિકારીઓ અને નોકરોની ફરજો ઠરાવવી અને
- (ઘ) સ્થાયી સમિતિના હુકમોને આધિન રહીને, સદરહુ અધિકારીઓ અને નોકરોના કાર્યો અને કાર્યવાહીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવું અને વિનિયમોને આધિન રહીને સદરહુ અધિકારીઓ અને નોકરોની નોકરી, મહેનતાણુ અને વિશેષાધિકારોને લગતા પ્રશ્નોનો નિકાલ કરવો.
- (ચ) સેન્ટ્રલ ઓફીસ ઓફીસ ઓર્ડર નં ૩૫ તા.૧૦-૯-૨૦૦૮ અનુસાર મ્યુ. કમિશનરશ્રીની તા.૯-૯ ૨૦૦૮ની મળેલ મંજૂરી અનુસાર મ્યુ. સેક્રેટરી ઓફીસના અપીલ અધિકારી તરીકેની ફરજો

પ્રકરણ-૫

પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો/વિનિયમો/સુચનાઓ/નિયમસંગ્રહો અને રેકર્ડ

દસ્તાવેજનું નામ / મથાળું	અન્ય
દસ્તાવેજ પરનું ટુંકુ લખાણ	પ્રોસીડીંગ્ઝ (બોર્ડ, જુદી જુદી સમિતિઓની કાર્યવાહી બુક)
વ્યક્તિને નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમસંગ્રહ મેળવવા અંગે	સેન્ટ્રલ રેકર્ડ ખાતેથી નિયત ફી ભરવાથી નકલ મળશે.
વિભાગ દ્વારા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને દફતરોની નકલ માટે લેવાની ફી (જો હોય તો)	ધી ગુજરાત પ્રવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના અનુસુચિ-ક (A) પ્રકરણ ૨-જુ કોર્પોરેશન સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ વિગેરેની કાર્યવાહીઓનું નિયમન કરતી જોગવાઈઓ પૈકી જોગવાઈ ૧(થ)(N) તથા અ.મ્યુ.કોર્પો.ના મેન્યુઅલ- ૧ નિયમો પ્રકરણ-૨ના નિયમ ૧(એન) મુજબ મ્યુ.કોર્પો.ની કાર્યવાહીની નોંધ તથા સદર મેન્યુઅલ-૧ના (ક) ખાસ સમિતિઓની રચના અને તેની કાર્યવાહીની નોંધના નિયમ ૭(પ)મુજબ મ્યુ.કોર્પો તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં ઓફીસ સમય દરમ્યાન કોઈ પણ યોગ્ય સમયે કોઈપણ મ્યુ.કાઉન્સીલરશ્રીને ચાર્જ ભર્યા વિના જોવા માટે ખુલ્લી રહેશે. જ્યારે અન્યને પચાસ પૈસાની ફી આપ્યેથી જોવા માટે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયમાં સઘળા વાજબી વખતે ખુલ્લી હોવી જોઈએ તે અનુસાર કોઈપણ વ્યક્તિ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સ્ટેન્ડીંગ કમિટી તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ અગાઉથી જાણ કરી એક્ટની જોગવાઈ અનુસાર નિયત ફી ભરીને જોઈ શકશે પરંતુ ઠરાવની નકલ મેળવવા માટે સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા નિયત ફી ભર્યેથી ઠરાવની નકલ પ્રાપ્ત થશે રોજકામની કાયદા વિષયક બાબતો મ્યુ.કાઉન્સીલરો સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે ખુલ્લી રખાતી નથી.

પ્રકરણ- ૬

પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

- (૧) વહીવટીતંત્ર દ્વારા રજુ થયેલ દરખાસ્તો મ્યુ. કોર્પો. બોર્ડ, સ્ટેન્ડીંગ કમિટી તથા જુદી જુદી ખાસ સમિતિઓ સમક્ષ રજુ કરી તેના અનુસંધાને મિટીંગમાં થતા નિર્ણય અનુસાર થયેલ ઠરાવો જરૂરી કાર્યવાહી સારુ વહીવટીતંત્ર તરફ પાઠવી તેની નકલ તથા પ્રોસીડીંગ્સ મ્યુ. સેક્રેટરી ખાતાના નિયંત્રણ હેઠળ રાખવામાં આવે છે.
- (૨) મ્યુ. સેક્રેટરી ખાતામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ / કર્મચારીઓનું વહીવટી રેકર્ડ

પ્રકરણ-૭

૭.૧ તેની નીતી અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજૂઆત માટેની વિધમાન કઈ ગોઠવણની વિગતો

નીતિ ઘડતર

અ.નં.	વિષય / મુદ્દો	શું જનતાની સહભાગીતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે?	જનતાની સહભાગીતા મેળવવા વ્યવસ્થા માટેની
૧.	નીતિ ઘડતર અથવા નીતિના અમલ સબંધી કમિશનરશ્રી તરફથી રજૂ થતી દરખાસ્તો	ના	ના પરંતુ, જનતા દ્વારા ચુંટીને મોકલેલ તેમના પ્રતિનિધિઓનું (કોર્પોરેટર / કાઉન્સીલરો) બોર્ડની રચના ધી જી.પી.એમ.સી. એક્ટ મુજબ થાય છે. આ બોર્ડ દ્વારા ધી જી. પી. એમ. સી. એક્ટની જોગવાઈઓ અનુસાર સ્થાયી સમિતિ તથા ખાસ સમિતીઓની રચના કરવામાં આવે છે. આમ બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓ તેમની સમક્ષ રજૂ થતી નીતિ ઘડતર અથવા નીતિના અમલ સબંધી કમિશનરશ્રી તરફથી આવેલ દરખાસ્તો અંગે નિર્ણયો કરે છે.

* આનાથી નાગરીકને કયા આધારે નીતિ વિષયક બાબતોનાં ઘડતર અને અમલમાં જનતાની સહભાગીતા નક્કી કરાઈ છે તે સમજવામાં મદદ થશે.

પ્રકરણ-૭

૭.૨ તેની નીતી અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજૂઆત માટેની વિધમાન કઈ ગોઠવણની વિગતો

નીતિ અમલ :

અ.નં.	વિષય / મુદ્દો	શું જનતાની સહભાગીતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે?	જનતાની સહભાગીતા મેળવવા વ્યવસ્થા માટેની
૧.	નીતિ અમલ માટે જનતાની અથવા તેમના પ્રતિનિધોની સલાહ / પરામર્શ / સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા	ના	ના પરંતુ, જનતા દ્વારા ચુંટીને મોકલેલ તેમના પ્રતિનિધોનું (કોર્પોરેટર / કાઉન્સીલરો) બોર્ડની રચના ધી જી.પી.એમ.સી. એક્ટ મુજબ રચાય છે. આ બોર્ડ તેમના કાર્યો કરવા માટે ધી જી. પી. એમ. સી. એક્ટની જોગવાઈઓ અનુસાર સ્થાયી સમિતિની રચના કરે છે. બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓની મીટીંગો મળતી હોય છે તેમાં અવાર-નવાર નક્કી થયેલ નીતિઓની અમલવારી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે.

પ્રકરણ-૮

તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ ?

૮.૧ : જાહેર તંત્રને બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળો અંગેની વિગત નીચેના નમૂનામાં આપો.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો)	કોર્પોરેશન (બોર્ડ)
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટૂંકો પરિચય (સંસ્થાની સ્થાપના વર્ષ / મુખ્ય પ્રવૃત્તિઓ / ઉદ્દેશ)	સને ૧૮૩૪ માં શહેર સુધરાઈની સ્થાપના બાદ સને ૧૮૫૮ થી કાયદેસર મ્યુનિસિપાલીટીની શરૂઆત થઈ. સને ૧૯૫૦ માં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની રચના થઈ. શહેરના લોકોને પાયાની સુવિધાઓ અને સુખાકારી પુરી પાડવાના કાર્યો જેવા કે પાણી, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, રસ્તા, વીજળી, બગીચા.
માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર સંચાલક / કાર્યકારી / અન્ય)	સંચાલક
માળનું અને સભ્ય બંધારણ	ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (અધિનિયમ) ૧૯૪૯ તથા નામદાર સરકારશ્રીના વખતો વખતના આદેશોને આધિન.
સંસ્થાના વડા	મેયરશ્રી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી, મ્યુ. કમિશનરશ્રી
મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રીજો માળ, સી બ્લોક, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧
બેઠકની સંખ્યા	મ્યુ.કાઉ.બેઠકોની સંખ્યા - ૧૯૨ ઇલેક્શન વોર્ડની સંખ્યા - ૪૮

<p>શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે ?</p>	<p>ના, પરંતુ, દરેક સભા જાહેર જનતા માટે ખુલ્લી રહેશે. સિવાય કે સભામાં હાજર હોય તેવા સદસ્યો બહુમતીથી ઠરાવ પસાર કરીને એવો નિર્ણય કરે કે મહાનગરપાલિકા સમક્ષ ચાલુ હોય એવી કોઈપણ બાબત, ચોક્કસાઈ અથવા વિચારણા એવી છે કે તે ખાનગીમાં કરવી જોઈએ. આવો ઠરાવ અધ્યક્ષ સ્થાન લેનાર પોતાની મેળે અથવા સભામાં હાજર હોય એવા કોઈપણ સદસ્યોની વિનંતી પરથી અગાઉ ચર્ચા કર્યા સિવાય રજૂ કરવો જોઈએ. આ ઉપરાંત પ્રેક્ષક કક્ષના પ્રવેશનું નિયમન નીચે મુજબ કરવામાં આવશે.</p> <p>મહાનગરપાલીકાના સેક્રેટરી તરફથી દરેક સભ્યને તેમના મહેમાન માટે પ્રેક્ષક કક્ષમાં પ્રવેશ આપવા માટે સભાના એક કલાક અગાઉથી સભાગૃહની પ્રેક્ષક કક્ષની બેઠક સંખ્યાની મર્યાદામાં દરેક સદસ્યને સરખી સંખ્યામાં પાસ આપવામાં આવશે. પ્રેક્ષક કક્ષની બેઠકો માટેના પ પ્રવેશ પત્રો મેયરશ્રીના મહેમાનો માટે અનામત રહેશે. જો પાસ માટેનો ધસારો વધારે હશે તો પ્રવેશ પત્રોનો સમય એક કલાક પુરતો મર્યાદીત રહેશે.</p> <p>જો કોઈપણ મુલાકાતી સભાના કામકાજને ખલેલ પહોંચાડશે તો સભાપતિ તેમને પ્રેક્ષક કક્ષ ખાલી કરીને તાત્કાલીક ચાલ્યા જવા નિર્દેશ કરે તો મુલાકાતીએ તે મુજબ ચાલ્યા જવું પડશે. મુલાકાતી તેમ નહીં વર્તે તો મેયર અગર તો અધ્યક્ષસ્થાન લેનાર સભ્ય તેમને દૂર કરવા માર્શલને આદેશ આપશે.</p>
<p>શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે ?</p>	<p>હા, કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે.</p>
<p>બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે ?</p>	<p>ધી ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના અનુસુચિ-ક (A) પ્રકરણ ૨-જુ કોર્પોરેશન સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ વિગેરેની કાર્યવાહીઓનું નિયમન કરતી જોગવાઈઓ પૈકી જોગવાઈ ૧(થ)(N) તથા અ.મ્યુ.કોર્પો.ના મેન્યુઅલ-૧ નિયમો પ્રકરણ-૨ના નિયમ ૧(એન) મુજબ મ્યુ.કોર્પો.ની કાર્યવાહીની નોંધ તથા સદર મેન્યુઅલ-૧ના (ક) ખાસ સમિતિઓની રચના અને તેની કાર્યવાહીની નોંધના નિયમ ૭(પ)મુજબ મ્યુ.કોર્પો તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં ઓફીસ સમય દરમ્યાન કોઈ પણ યોગ્ય સમયે કોઈપણ મ્યુ.કાઉન્સીલરશ્રીને ચાર્જ ભર્યા વિના જોવા માટે ખુલ્લી રહેશે. જ્યારે અન્યને પચાસ પૈસાની ફી આપ્યેથી જોવા માટે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયમાં સઘળા વાજબી વખતે ખુલ્લી હોવી જોઈએ તે અનુસાર કોઈપણ વ્યક્તિ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સ્ટેન્ડીંગ કમિટી તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ અગાઉથી જાણ કરી એક્ટની જોગવાઈ અનુસાર નિયત ફી ભરીને જોઈ શકશે પરંતુ ઠરાવની નકલ મેળવવા માટે સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા નિયત ફી ભર્યેથી ઠરાવની નકલ પ્રાપ્ત થશે રોજકામની કાયદા વિષયક બાબતો મ્યુ.કાઉન્સીલરો સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે ખુલ્લી રખાતી નથી.</p>


પ્રકરણ-૯

તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા મ્યુનિસિપલ સેક્રેટરીની ઓફીસ

નામ અને હોદ્દો	ટેલિફોન નંબર ઓફીસ/ એક્ષ્ટેન્શન નં
શ્રી અરૂણભાઈ આર. પંડયા મ્યુનિસિપલ સેક્રેટરી	૨૫૩૯૭૭૭૮ ૨૫૩૯૧૮૧૧/૬૦૭ ૯૩૭૬૦ ૧૮૫૮૮
શ્રી દિનેશ ટી. ચોટલીયા પી.એસ. કમ સ્ટેનો ટુ મેયર	૨૫૩૨૯૦૦૯ ૨૫૩૯૧૮૧૧/૬૦૧/૬૦૪ ૯૭૧૨૯૬૭૮૨૦
શ્રી કુંજન વી. શાહ પી.એ. ટુ ચેરમેન-સ્ટે.કમિટી	૨૫૩૯૧૮૧૧/૬૦૬/૬૦૯ ૯૯૭૮૯૨૮૧૭૫
શ્રી ધવલ ભરતભાઈ ભટ્ટ પી.એ. ટુ ડેપ્યુટી મેયર	૨૫૩૯૧૮૧૧ / ૬૦૫ / ૪૮૧ ૯૮૨૫૧૮૭૦૫૫
શ્રી રમેશભાઈ ડી. ગોહીલ ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ	૨૫૩૯૧૮૧૧ / ૪૨૭ ૯૯૯૮૩૭૩૬૨૬

પ્રકરણ-૯

તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા



પ્રકરણ-૧૦

તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પધ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર.

અ.નં.	હોદ્દો	શીડ્યુલ પરની જગ્યાની સંખ્યા	મે -૨૦૨૨ એક અધિકારી /કર્મચારીને માસિક ચુકવાતુ મહેનતાણુ
૧.	મ્યુ. સેક્રેટરી	૧	૨,૩૭,૪૭૮
૨.	ડે.મ્યુ.સેક્રેટરી	૧	જગ્યા ખાલી
૩.	પી. એસ. ટુ. મેયર	૧	જગ્યા ખાલી
૪.	પી. એસ. કમ સ્ટેનો ટુ મેયર	૧	જગ્યા ખાલી
૫.	સ્ટેનોગ્રાફર (ગુજરાતી)	૧	જગ્યા ખાલી
૬.	ટાઈપીસ્ટ કમ કલાર્ક	૪	જગ્યા ખાલી
૭.	ઓફીસ સુપ્રિ (વેલ્યુએશન ઓફીસર કક્ષાના)	૪	૮૫,૮૬૩
૮.	પી.એસ. કમ પી. આર. ઓ. ટુ સ્ટે. કમિટી	૧	જગ્યા ખાલી
૯.	હેડ કલાર્ક કક્ષાના	૭	૮૫,૪૫૬
૧૦.	સીની. કલાર્ક	૧૩	૮૦,૫૪૫
૧૧.	જુની. કલાર્ક	૩	૪૪,૦૩૦
૧૨.	હેડ ડ્રાઈવર કમ મીકેનીક	૧	૭૪,૮૨૬
૧૩.	ડ્રાઈવર	૨૪	૭૬,૪૯૬
૧૪.	નાયક	૫	૪૭,૮૪૦
૧૫.	પટાવાળા	૩૯	૫૩,૬૫૬
૧૬.	લેડી એટેન્ડન્ટ	૨	જગ્યા ખાલી
૧૭.	ક્લીનર	૩	જગ્યા ખાલી
૧૮.	એટેન્ડન્ટ	૪	૪૨,૩૩૬
		૧૧૫	

પ્રકરણ-૧૧

તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ વહેંચણી પરના અહેવાલોની વિગતો
દર્શાવતી તેની દરેક એજન્સી ફાળવેલ અંદાજપત્ર

મ્યુ. સેક્ટરી ઓફીસના બજેટ હેડ વર્ષ ૨૦૨૨-૨૦૨૩

અ.નં.	બજેટ હેડ	કોડ નં.	મંજૂર થયેલ રકમ (રૂ. લાખમાં)
૧.	પગાર ખર્ચ	૩૦૧૯૯	૩૦૯.૯૭
૨.	ટેલીફોન બીલ (રહેઠાણ)	૩૦૩૦૨	૦.૫૦
૩.	મેડીકલ ખર્ચ (કાઉન્સીલર માટે) રીએમ્બર્સમેન્ટ	૩૦૩૦૯	૨૫.૦૦
૪.	યુનિફોર્મ	૩૦૪૦૧	૩.૦૦
૫.	ટેલીફોન તથા ટ્રન્કકોલ ઓફીસ માટે	૩૪૧૦૧	૩૫.૦૦
૬.	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૩૪૧૦૨	૨.૦૦
૭.	ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ મેયર્સની વાર્ષિક સભાસદ ફી	૩૪૨૧૫	૦.૫૦
૮.	સ્ટેશનરી	૩૪૪૦૧	૯.૦૦
૯.	કોમ્પ્યુટર સ્ટેશનરી	૩૪૪૦૨	૨.૦૦
૧૦.	પ્રિન્ટીંગ	૩૪૪૦૪	૭.૬૫
૧૧.	ઝેરોક્ષ	૩૪૪૦૫	૨.૫૦
૧૨.	વાર્ષિક મહોત્સવ, તહેવારો, ઉજવણી પ્રસંગો	૩૪૭૦૧	૩૫.૦૦
૧૩.	સ્મૃતિ ચિન્હો, (મોમેન્ટો) - નેમપ્લેટસ	૩૪૭૦૨	૦.૨૦
૧૪.	મેયરશ્રી નગર રત્ન એવોર્ડ	૩૪૭૧૫	૨૫.૦૦
૧૫.	જાહેર ખબર તથા પબ્લિસિટી	૩૪૮૦૧	૧૦.૦૦
૧૬.	મ્યુ. કાઉન્સીલરશ્રીઓના ઓનેરેરીયમ તથા ભથ્થાઓ	૩૪૮૦૩	૪૨૫.૦૦
૧૭.	કમિટીના ખર્ચા	૩૪૮૦૪	૨.૦૦
૧૮.	પુસ્તકો, અખબારો, સામાયિકો, રમકડા	૩૪૮૦૮	૦.૭૫
૧૯.	જુના દસ્તાવેજો ના કોમ્પ્યુટરાઈઝેશનનું તથા માઈક્રો ફીલ્મીંગ અંગેનું ખર્ચ	૩૪૮૧૬	૫.૦૦
૨૦.	ડીસ્કીશનલ કન્ટીજન્સી	૩૪૮૨૦	૫૦.૦૦
૨૧.	અન્ય ખર્ચા	૩૪૮૯૯	૧૪.૦૦
૨૨.	સંદેશા વ્યવહારના સાધનો, ટેલીફોન, વાયરલેસ	૩૮૭૦૭	૦.૦૦
૨૩.	એરકન્ડીશનર, એરકુલર્સ, રેફ્રીજરેટર્સ તથા વોટર કુલર્સ	૩૮૭૦૮	૩.૦૦
૨૪.	મોટરકાર તથા જીપ	૩૮૮૦૧	૨૦.૦૦
૨૫.	ટેબલ તથા ખુરશી, બાંકડા, બેન્ચ	૩૯૦૦૧	૧.૦૦
૨૬.	અન્ય વિજળી ખર્ચ (લાઈટ એનર્જી)	૪૩૧૦૨	૨.૫૦
૨૭.	વહીવટી સુધારણા, તપાસ, સંશોધન તથા જાહેર લોકમતના ખર્ચા	૪૮૪૦૫	૭૫.૦૦
	કોર્પોરેશન કમિટી તથા સેક્ટરી ની ઓફિસ - કુલ		૧૦૬૫.૫૭
તથા	પેઈજીંગ / મોબાઈલ	૬૪૭૧૪	૫૦.૦૦

નોંધ :- ઉપરોક્ત વિગતો નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ છે.

પ્રકરણ-૧૪

ઇલેક્ટ્રોનિક સ્વરુપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહિતીને લગતી વિગતો

(૧) વહીવટીતંત્ર દ્વારા રજુ થયેલ કામો મ્યુ. કોર્પો. બોર્ડ, સ્ટેન્ડીંગ કમિટી તથા જુદી જુદી ખાસ સમિતિઓ સમક્ષ રજુ કરી તેના અનુસંધાને મિટીંગમાં થતા નિર્ણય અનુસાર પસાર થયેલ ઠરાવો ઇલેક્ટ્રોનિક સ્વરુપમાં ઉપલબ્ધ હોય તે જ સને જુલાઈ -૨૦૦૧ થી અમલમાં છે.પરંતુ પ્રો એક્ટીવ ડીસ્ક્લોઝરના મુદ્દા નંબર ૧૫ અનુસાર ઠરાવની નકલ મ્યુ.કોર્પો.ની સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગના ઠરાવ નંબર ૫ તારીખ ૩-૪-૧૯૯૯ તથા મ્યુ. કોર્પો. ઠરાવ નંબર ૪૬ તા.૨૨-૪-૧૯૯૯ અનુસાર મ્યુ. કોર્પો.ના સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા મેળવવાની રહેશે. સ્ટે.કમિટી ઠરાવ નં. ૪૧૮ તા.૧૩-૦૯-૨૦૧૯ ઠરાવની નકલના દરમાં વધારો થઈ પ્રતિ ઠરાવની નકલ ફી રૂા. ૧૦૦/- નક્કી થયેલ છે.

(૨) માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪ અંતર્ગત પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર (સ્વયં જાહેર કરવાની બાબતો) મ્યુ. સેક્રેટરી ઓફીસને લગતી તા.૧-૫-૨૦૨૨ ની સ્થિતિએ અદ્યતન કરી ઇલેક્ટ્રોનિક સ્વરુપમાં સમાવાયેલ છે તથા મ્યુ. કોર્પો.ની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પ્રકરણ-૧૫

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.

૧૫.૧	લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પધ્ધતિઓ અથવા સવલતો ની વિગત	ધી ગુજરાત પ્રવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના અનુસુચિ-ક (A) પ્રકરણ ૨-જુ કોર્પોરેશન સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ વિગેરેની કાર્યવાહીઓનું નિયમન કરતી જોગવાઈઓ પૈકી જોગવાઈ ૧(થ)(N) તથા અ.મ્યુ. કોર્પો.ના મેન્યુઅલ- ૧ નિયમો પ્રકરણ-૨ના નિયમ ૧(એન) મુજબ મ્યુ.કોર્પો.ની કાર્યવાહીની નોંધ તથા સદર મેન્યુઅલ-૧ના (ક) ખાસ સમિતિઓની રચના અને તેની કાર્યવાહીની નોંધના નિયમ ૭(પ)મુજબ મ્યુ.કોર્પો તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં ઓફીસ સમય દરમ્યાન કોઈ પણ યોગ્ય સમયે કોઈપણ મ્યુ.કાઉન્સીલરશ્રીને ચાર્જ ભર્યા વિના જોવા માટે ખુલ્લી રહેશે. જ્યારે અન્યને પચાસ પૈસાની ફી આપ્યેથી જોવા માટે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયમાં સઘળા વાજબી વખતે ખુલ્લી હોવી જોઈએ તે અનુસાર કોઈપણ વ્યક્તિ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સ્ટેન્ડીંગ કમિટી તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ અગાઉથી જાણ કરી એક્ટની જોગવાઈ અનુસાર નિયત ફી ભરીને જોઈ શકશે પરંતુ ઠરાવની નકલ મેળવવા માટે સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા નિયત ફી ભર્યેથી ઠરાવની નકલ પ્રાપ્ત થશે રોજકામની કાયદા વિષયક બાબતો મ્યુ.કાઉન્સીલરો સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે ખુલ્લી રખાતી નથી. જ્યારે અન્યને પચાસ પૈસાની ફી આપ્યેથી જોવા માટે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયમાં સઘળા વાજબી વખતે ખુલ્લી હોવી જોઈએ તે અનુસાર કોઈપણ વ્યક્તિ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સ્ટેન્ડીંગ કમિટી તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ અગાઉથી જાણ કરી એક્ટની જોગવાઈ અનુસાર નિયત ફી ભરીને જોઈ શકશે પરંતુ ઠરાવની નકલ મ્યુ.કોર્પો.ની સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગના ઠરાવ નંબર ૫ તા.૩-૪-૧૯૯૯ તથા મ્યુ. કોર્પો. ઠરાવ નંબર ૪૬ તા.૨૨-૪-૧૯૯૯ અનુસાર મ્યુ. કોર્પો.ના સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા મેળવવાની રહેશે. સ્ટે.કમિટી ઠરાવ નં. ૪૧૮ તા.૧૩-૦૯-૨૦૧૯ ઠરાવની નકલના દરમાં વધારો થઈ પ્રતિ ઠરાવની નકલ ફી રૂ. ૧૦૦/- નક્કી થયેલ છે.
૧૫.૨	માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ ૪ અંતર્ગત પ્રો-એક્ટીવ ડીસ્ક્લોઝર (સ્વયં જાહેર કરવાની બાબતો) મ્યુ. સેક્રેટરી ઓફીસને લગતી તા.૧-૫-૨૦૧૯ ની સ્થિતિએ અદ્યતન કરવામાં આવેલ છે.	નાગરિકોની જાણ માટે મ્યુ. કોર્પો.ની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પ્રકરણ-૧૬

જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો

મ્યુ. સેક્રેટરી ઓફીસ

અમદાવાદ મહાનગર સેવા સદન, ત્રીજો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ,
ગોળલીમડા, અમદાવાદ.

ઓફીસ સમય : સવારે ૧૧-૩૦ થી સાંજે ૭-૧૦

રિસેસ : બપોરે ૨-૦૦ થી ૨-૩૦

શ્રી અરુણ આર. પંડયા

મ્યુનિસિપલ સેક્રેટરી અને અપીલ અધિકારી

ટેલીફોન નંબર :

૨૫૩૫૨૫૩૫

૨૫૩૯૧૮૧૧/૬૦૭

(મો.) ૯૩૭૬૦૧૮૫૮૮

શ્રી રમેશભાઈ ડી. ગોહીલ

ઓફીસ સુપ્રિટેન્ડન્ટ અને જાહેર માહિતી અધિકારી

ટેલીફોન નંબર :

૨૫૩૯૧૮૧૧/૪૨૭ મો. નં. ૯૯૯૮૩૭૩૬૨૬

મ્યુ. સેક્રેટરી ઓફીસ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન,
મહાનગર સેવા સદન, સી બ્લોક, ત્રીજો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ,
ગોળલીમડા, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

: ૨૧ :

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

ચૂંટાયેલી પાંખ

મેયર

ડેપ્યુટી મેયર

સ્ટેન્ડીંગ કમિટી

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી

મ્યુ. ટ્રાન્સપોર્ટ કમિટી

રોડઝ એન્ડ બિલ્ડીંગ કમિટી

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી

મ્યુનિસિપલ સ્કુલબોર્ડ

હોસ્પિટલ કમિટી

સ્ટાફ સીલેક્શન એન્ડ
એપોઈન્ટમેન્ટ કમિટી

રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી

ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી

હાઉસીંગ, ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ઈ.ડબલ્યુ.એસ.
આવાસ યોજના કમિટી

લીગલ કમિટી

રેવન્યુ કમિટી

મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઈઝ કમિટી

મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી

પ્રકરણ-૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી ચૂંટાયેલા હોદ્દાદારો, પક્ષના કાર્યાલયો

નામ અને હોદ્દો	ઓફીસ	એક્ષે.	રહેઠાણ / મોબાઇલ
શ્રી કિરીટભાઈ જે. પરમાર મેયરશ્રી	૨૫૩૨૯૦૦૯ ફેક્સ ૨૫૩૫૨૯૮૮	૬૦૧ ૬૦૪ ૪૦૩ ૫૯૧	૨૬૪૬૩૪૪૫ (મેયર બંગલો) ૯૩૭૪૨૩૦૯૫૭
શ્રી ગીતાબેન જે. પટેલ ડે.મેયરશ્રી	૨૫૩૫૪૩૨૨	૬૦૫ ૪૮૧	૯૩૨૮૭૮૪૫૬૪
શ્રી હિતેષભાઈ બારોટ ચેરમેનશ્રી - સ્ટેન્ડીંગ કમિટી	૨૫૩૫૨૪૨૪	૬૦૬ ૬૦૯ ૭૨૮	૯૮૨૪૦૧૦૦૨૨
શ્રી અરૂણસિંહ રાજપુત ઈંડકશ્રી	૨૫૩૯૧૮૧૧	૮૦૫	૯૩૨૮૭૮૪૫૧૧
શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ નેતાશ્રી, મ્યુ. ભા.જ.પ.	૨૫૩૫૦૯૭૬	૬૧૦	૯૩૨૭૪૨૬૦૬૩
શ્રી શહેઝાદખાન પઠાણ નેતાશ્રી - મ્યુ. કોંગ્રેસ	૨૫૩૯૧૮૧૧ ફેક્સ ૨૫૩૫૨૪૬૩	૪૦૧ ૭૦૯	૯૫૩૭૯૯૦૭૫૭
ભારતીય જનતા પક્ષ કાર્યાલય			
કાર્યાલય મંત્રી : મ્યુ.ભા.જ.પ (૧) શ્રી અનિલ ભગત મો.નં.: ૯૩૨૮૪૯૯૯૦૮ ફોન નં. ૨૫૩૯૧૮૧૧ એક્ષે. ૫૦૨, ૫૦૩, ૫૦૪, ૫૦૫, ૫૦૮, ૫૧૨, ૫૧૩, ૬૦૨, ૬૨૧, ૭૪૫			
કોંગ્રેસ પક્ષ કાર્યાલય			
કાર્યાલય મંત્રી : -શ્રી જગદીશકુમાર એલ. પઢીયાર મો.નં.-૯૪૨૮૪૯૯૯૦૮ ફોન નં. ૨૫૩૯૧૮૧૧ એક્ષે. ૪૫૧, ૪૫૨, ૪૫૩, ૪૦૫, ૭૧૪, ૭૫૧, ૭૫૨			

પ્રકરણ-૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી
 મ્યુનિસિપલ કોર્પો.ની વિવિધ ખાસ કમિટીઓના ચેરમેનશ્રીઓની યાદી

ચેરમેનશ્રીનું નામ / કમિટીનું નામ	ઓફીસ ફોન નંબર	એક્સે.	મોબાઇલ નંબર
શ્રી વલ્લભભાઈ કુબેરભાઈ પટેલ ચેરમેનશ્રી - ટ્રાન્સપોર્ટ કમિટી	૨૫૩૫૨૨૪૩ ૨૫૩૯૧૮૧૧	૫૧૩ ૪૧૪ ૪૨૪	૯૩૨૭૪૨૬૦૮૦
શ્રી જતીનકુમાર ઝવેરભાઈ પટેલ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૧૨	૯૩૨૮૭૮૪૫૨૦
શ્રી મહાદેવભાઈ વશરામભાઈ દેસાઈ રોડઝ એન્ડ બિલ્ડીંગ કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૧૩	૯૮૨૫૩૦૩૧૯૯
શ્રી ભરતભાઈ કેશવલાલ પટેલ હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી	૨૫૩૯૧૮૧૧	૪૨૫	૭૮૧૯૮૭૦૫૦૫
શ્રી પરેશભાઈ હરગોવિંદભાઈ પટેલ હોસ્પિટલ કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૧૪	૯૯૨૫૦૨૨૧૮૫, ૯૮૭૯૦૯૪૮૯૦
શ્રી રાજેશકુમાર ઘનશ્યામભાઈ દવે (રાજુભાઈ) રીફી કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૧૯	૯૪૨૬૫૦૬૦૯૦, ૯૮૨૫૨૭૫૦૫૦
શ્રી દેવાંગ જિતેન્દ્રભાઈ દાણી ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૩૭	૯૪૨૬૩૦૨૫૨૦
શ્રી અશ્વિન બાબુભાઈ પેયાણી હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇ. ડબલ્યુ.એસ. આવાસ યોજના કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૧૭	૯૩૨૮૭૮૪૬૦૮
શ્રી જૈનિક નૌતમભાઈ વકીલ રેવન્યુ કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૨૮	૯૮૨૫૧૫૯૬૧૭
શ્રી કૌશિકભાઈ નટવરલાલ પટેલ લીગલ કમિટી	૨૫૩૯૧૮૧૧	૭૪૩	૯૪૨૬૦૬૭૫૬૫, ૯૯૭૮૫૪૧૯૪૯
શ્રી આશિષ અમૃતલાલ પટેલ મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૧૮	૯૮૭૯૫૫૫૯૬૩
શ્રી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી	૨૫૩૯૧૮૧૧	૬૧૬	૯૦૯૯૦૩૬૭૭૩ ૭૫૬૭૦૪૪૫૫૮

પ્રકરણ-૧૭

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

તા.૨-૫-૨૦૨૧ થી તા.૧-૫-૨૦૨૨ દરમ્યાન અમદાવાદ જિલ્લામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બંધારણીય કામકાજ દર્શાવતું પત્રક (તા. ૧-૫-૨૦૨૨ ની સ્થિતિએ)

૧	અનુક્રમ નંબર	:	૧
૨	મહાનગરપાલિકાનું નામ	:	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
૩	જેના અન્વયે બંધારણ થયું હોય તે અધિનિયમ	:	ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુ.કોર્પો. એક્ટ-૧૯૪૯
૪	નિયુક્ત બેઠકો સહિતની બેઠકોની કુલ સંખ્યા	:	૧૯૨
૫	(ક) નિયુક્ત કરેલ (ખ) મતદાર મંડળો (વિભાગ) દ્વારા ચૂંટાયેલા સભ્યો	:	૧૯૨
૬	(ક) મહિલા અનામત (૧) સામાન્ય : ૭૫ (૨) અનુ. જાતિ : ૧૦ (૩) અનુ. આદિ જાતિ : ૦૧ (૪) પછાત વર્ગ : ૧૦ કુલ : ૯૬	:	૯૬
	(ખ) (૧) અનુ.જાતિ માટે અનામત બેઠકો (કુલ ૨૦ પૈકી ૧૦ મહિલા અનામત)	:	૧૦
	(૨) પછાત વર્ગ માટે અનામત બેઠકો (કુલ-૧૯ પૈકી ૧૦ મહિલા અનામત)	:	૯
	(ગ) આદિજાતિ માટે અનામત (કુલ-૨ પૈકી ૧ મહિલા અનામત)	:	૧
	કુલ અનામત	:	૧૧૬
૭	સામાન્ય બેઠકો	:	૭૬
૮	કુલ બેઠકો	:	૧૯૨
૯	યોજાયેલી કુલ બેઠકોની સંખ્યા : (તા.૨-૫-૨૦૨૧ થી તા.૧-૫-૨૦૨૨)	:	૧૪
૯ એ	યોજાયેલી બેઠકો દરમ્યાન નિકાલ કરેલ કામોની સંખ્યા (તા.૨-૫-૨૦૨૧ થી તા.૧-૫-૨૦૨૨)	:	૬૪૩

૧૦	આસન-૯ માં કુલ બેઠકોમાંથી કાર્યસાધક સંખ્યા (કોરમ) ના અભાવે નિષ્ફળ સાબિત થઈ હોય તેવી બેઠકોની સંખ્યા.	:	-
૧૧	આસન-૯ માંથી કુલ બેઠકોમાંથી મુલતવી રાખવામાં આવી હોય તેવી બેઠકોની સંખ્યા.	:	૦
૧૨	દરેક બેઠકમાં હાજર હોય તેવા સભ્યની સરેરાશ ટકાવારી	:	૯૨.૪૨

પ્રકરણ-૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

તા.૨-૫-૨૦૨૧ થી તા.૧-૫-૨૦૨૨ દરમ્યાન મળેલ મ્યુનિસિપલ બોર્ડની મીટીંગોમાં
કાઉન્સિલરશ્રીની સરેરાશ હાજરી

અ.નં.	મીટીંગની તારીખ	સભ્ય સંખ્યા	કુલ સંખ્યા	ખાલી જગા	હાજર સભ્ય સંખ્યા	હાજરીની ટકાવારી
૧.	૨૮-૦૫-૨૦૨૧ (૩૦/૦૪/૨૦૨૧ ની મોકુફ સભા)	૧૯૨	૧૯૧	૧	૧૮૯	૯૮.૯૫
૨.	૨૫-૦૬-૨૦૨૧	૧૯૨	૧૯૧	૧	૧૫૪	૮૦.૬૩
૩.	૩૦-૦૭-૨૦૨૧	૧૯૨	૧૯૦	૨	૧૮૦	૯૪.૭૪
૪.	૨૭-૦૮-૨૦૨૧	૧૯૨	૧૯૦	૨	૧૮૦	૯૪.૭૪
૫.	૨૪-૦૯-૨૦૨૧	૧૯૨	૧૯૦	૨	૧૭૮	૯૩.૬૮
૬.	૨૬-૧૦-૨૦૨૧	૧૯૨	૧૯૨	૦	૧૭૪	૯૦.૬૩
૭.	૨૬-૧૧-૨૦૨૧	૧૯૨	૧૯૨	૦	૧૭૨	૮૯.૫૮
૮.	૨૪-૧૨-૨૦૨૧	૧૯૨	૧૯૨	૦	૧૮૨	૯૪.૭૯
૯.	૨૪-૦૧-૨૦૨૨	૧૯૨	૧૯૨	૦	૧૬૬	૮૬.૪૬
૧૦.	૧૮-૦૨-૨૦૨૨	૧૯૨	૧૯૨	૦	૧૮૫	૯૬.૩૫
૧૧.	૧૯-૦૨-૨૦૨૨	૧૯૨	૧૯૨	૦	૧૮૪	૯૫.૮૩
૧૨.	૨૫-૦૨-૨૦૨૨	૧૯૨	૧૯૨	૦	૧૭૫	૯૧.૧૫
૧૩.	૨૫-૦૩-૨૦૨૨	૧૯૨	૧૯૨	૦	૧૭૬	૯૧.૬૭
૧૪.	૨૫-૦૪-૨૦૨૨	૧૯૨	૧૯૨	૦	૧૮૨	૯૪.૭૯

- બારમાસની સરેરાસ હાજરી : ૯૨.૪૨
- મ્યુ.કા.શ્રી પ્રતિમા ભાનુપ્રસાદ સક્શેનાએ તા.૧૬/૦૪/૨૦૨૧ એ રાજીનામું આપેલ હોઈ તેમજ શ્રી ગૌતમભાઈ બાબરભાઈ પટેલનું તા.૨૮/૦૭/૨૦૨૧ ના રોજ અવસાન થયેલ હોવાથી કુલ બે જગ્યાઓ ખાલી પડેલ હતી.
- તા.૦૫/૧૦/૨૦૨૧ થી પેટા ચૂંટણીમાં ખાલી પડેલ બે જગ્યાઓ પર (૧) શ્રી રીટાબેન રાજેન્દ્રભાઈ પટેલ તથા (૨) શ્રી મૌલિકભાઈ ગૌતમભાઈ પટેલ ચૂંટાઈ આવેલ છે.

પ્રકરણ-૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

સને ૨-૫-૨૦૨૧ થી ૧-૫-૨૦૨૨ સુધીમાં મળેલ સ્ટેચ્યુટરી તથા સ્પેશીયલ કમિટીઓએ કરેલ કામગીરી નીચેના પત્રકમાં દર્શાવવામાં આવી છે.

અ.નં.	કમિટીનું નામ	બેઠકની સંખ્યા	નિકાલ કરેલ કામોની સંખ્યા
૧.	સ્ટેન્ડીંગ કમિટી	૫૭	૯૬૨

સ્પેશીયલ કમિટીઓ

અ.નં.	કમિટીનું નામ	બેઠકની સંખ્યા	નિકાલ કરેલ કામોની
૧.	વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી	૨૩	૧૯૯
૨.	રોડઝ એન્ડ બિલ્ડીંગ કમિટી	૨૩	૨૭૩
૩.	હોસ્પિટલ કમિટી	૨૧	૯૪
૪.	લીગલ કમિટી	૨૨	૩૮
૫.	સ્ટાફ સીલેક્શન એન્ડ એપો.કમિટી	૦૩	૨૧
૬.	હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી	૨૨	૧૪૦
૭.	ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી	૧૪	૬૬
૮.	હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇ.ડબલ્યુ.આવાસ યોજના કમિટી	૨૨	૨૪
૯.	રીક્રીએશન, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી	૧૭	૬૩
૧૦.	રેવન્યુ કમિટી	૨૧	૪૦
૧૧.	મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટી	૧૯	૫૨
૧૨.	મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી	૨૩	૪૧

પ્રકરણ-૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

નામદાર ગુજરાત સરકારશ્રીના તા.૦૧-૧૦-૨૦૧૮ના ઠરાવ ક્રમાંક AMN/૧૦૨૦૧૮/૬૪૨૧/P થી મળેલ મંજૂરી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલ મ્યુ. કાઉન્સિલરશ્રીઓને નીચે જણાવેલ વિગતે માનદ વેતન, મિટીંગ એલાઉન્સ, સ્ટેશનરી એલાઉન્સ, ટેલીફોન એલાઉન્સ ચુકવવામાં આવે છે.

- (૧) માનદ વેતન(ઓનરેરીયમ)માસિક રૂા.૧૨,૦૦૦/- (અંકે રૂપીયા બાર હજાર પુરા) ચુકવવામાં આવે છે.
- (૨) મ્યુ. બોર્ડની બેઠક, સ્ટેન્ડીંગ કમિટી તથા અન્ય સ્પે. કમિટીઓની મિટીંગમાં હાજર રહે તો તે પ્રત્યેક મિટીંગ દીઠ રૂા.૫૦૦/- (અંકે રૂપીયા પાંચસો પુરા)લેખે મિટીંગ એલાઉન્સ ચુકવવામાં આવે છે.
- (૩) ટેલીફોન એલાઉન્સ પેટે માસિક રૂા.૧૦૦૦/- (અંકે રૂપીયા એક હજાર પુરા) ચુકવવામાં આવે છે.
- (૪) સ્ટેશનરી એલાઉન્સ પેટે માસિક રૂા.૧૫૦૦/- (અંકે રૂપીયા એક હજાર પાંચસો પુરા) ચુકવવામાં આવે છે.
- (૫) મ્યુનિસિપલ કમિશનરશ્રીના તા.૩૦-૧-૨૦૧૭ના સરકયુલર અનુસાર નક્કી થયેલ મોબાઈલ પોલીસી મુજબ દરેક ચૂંટાયેલ મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓને ૨.૫ વર્ષે મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટની ખરીદી પેટે તેઓ દ્વારા બિલ/વાઉચર રજુ થયેથી રૂા.૧૨,૦૦૦/- (અંકે રૂપીયા બાર હજાર પુરા)ની મર્યાદામાં રીઈમ્બર્સમેન્ટ કરી આપવામાં આવે છે.
- (૬) સ્ટે.ક.ઠ.નં. ૭૦૫ તા.૨૧-૦૮-૨૦૦૧ તથા મ્યુ.કોર્પો. ઠ.નં. ૫૨૦ તા. ૨૩-૧૦-૨૦૦૧ના અનુસંધાને સ્ટે.ક.ઠ.નં. ૯૭૨ તા.૧૭-૦૮-૨૦૦૭ અનુસાર નક્કી થયેલ નીતિ અનુસાર ચૂંટાયેલ મ્યુ. કાઉન્સિલરશ્રીઓને દર વર્ષે સ્ટેશનરી છપાવીને આપવામાં આવે છે જે અનુસાર સ્ટે કમિટી ઠ.નં.૮૮૧ તા.૦૮/૦૩/૨૦૨૨ થી મળેલ મંજૂરી મુજબ વર્ષ ૨૦૨૧-૨૦૨૬ની ટર્મના બીજા વર્ષ માટે ૨૦ (વીસ) પેડની મર્યાદામાં સ્ટેશનરી છપાવીને આપવામાં આવેલ છે. તથા પેન સેટ આપવામાં આવેલ છે.
- (૭) સ્ટે.ક.ઠ.નં. ૩૭૯ તા.૧૦-૦૫-૧૯૭૮ તથા મ્યુ.કોર્પો. ઠ.નં. ૨૩૬ તા.૧૮-૭-૧૯૭૮થી નક્કી થયેલ સામાન્ય નીતિ તથા ત્યારબાદ વખતો વખત સ્ટેન્ડીંગ કમિટી તથા મ્યુ.કોર્પો.ના ઠરાવો અનુસાર મ્યુ.કોર્પો. સંચાલિત હોસ્પિટલમાં મ્યુ.કાઉન્સિલરશ્રીઓને તથા તેમના કુટુંબીજનોને વિનામુલ્યે વૈદકીય સારવારના લાભો આપવામાં આવે છે.

મ્યુનિસિપલ સેક્રેટરી ઓફીસ
એમ.એસ.નંબર : ૨૦૫
તારીખ : ૨૭-૦૭-૨૦૨૨

પ્રતિ
એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર અને
મદદનીશ જાહેર માહિતી અધિકારીશ્રી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ટેક્ષ મધ્યસ્થ કચેરી (આર.ટી.આઈ.સેલ)
પાંચમો માળ, સરદાર પટેલ ભવન
દાણાપીઠ અમદાવાદ.

વિષય : “એનેક્ષર-એ” મુજબનું પ્રમાણપત્ર મોકલવા બાબત.

માહિતી અધિકારી અધિનિયમ-૨૦૦૫

સંદર્ભ : - ડે. મ્યુનિ. કમિશનરશ્રી (આર.ટી.આઈ.)ના સરકયુલર નંબર : ૦૧ / સને ૨૦૨૨-૨૩
તા.૨૭-૦૫-૨૦૨૨ તથા સરકયુલર નં.૦૨ તા.૨૦૨૨/૨૩ તા.૩૦/૦૫/૨૦૨૨

ઉપરોક્ત વિષય તેમજ સંદર્ભમાં દર્શાવેલ સરકયુલર પરત્વે રાજ્ય સરકારશ્રીના સા.વ.વિ.ના પરિપત્ર પી.એ.ડી./૧૦/૨૦૦૭/ ૩૩૫૩૬૪ આર.ટી.આઈ. સેલ તા. ૦૧-૦૫-૨૦૦૮ની સુચના અનુસાર રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ હેઠળ માહિતી અધિકારી અધિનિયમની કલમ ૪(બ) પ્રો એક્ટીવ ડીસ્ક્લોઝર સ્વયં સમીક્ષા કરી પાઠવી આપવા જણાવેલ છે જેના અનુસંધાને અત્રે મ્યુ. સેક્રેટરી ઓફીસનું પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર (પી.એ.ડી.) (સ્વયં જાહેર કરવાની બાબતો) તા. ૦૧-૦૫-૨૦૨૨ની સ્થિતિએ અઘતન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઈટ પર અપલોડ કરવા સારુ info@ahmedabadcity.gov.in પર ઈમેલ દ્વારા મોકલેલ છે તેમજ પી.એ.ડી.ની એક હાર્ડ કોપી સહિત તા. ૦૧-૦૫-૨૦૨૨ની સ્થિતિએ પી.એ.ડી. અઘતન કર્યાનું પ્રમાણપત્ર “એનેક્ષર એ” મુજબનું આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે જે જાણમાં લેવા વિનંતી છે.

sd/-

જાહેર માહિતી અધિકારી
અને
ઓફીસ સુપ્રીટેન્ડન્ટ
મ્યુનિસિપલ સેક્રેટરી ઓફીસ

બિડાણ : પ્રમાણપત્ર “એનેક્ષર એ”

એનેક્ષર - એ

(સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૧-૦૫-૨૦ ૦૯ના પરિપત્ર ક્રમાંક:- ૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઈસેલ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી કચેરી મ્યુ. સેક્રેટરી ઓફિસ તથા મારા વહીવટી કાર્યક્ષેત્ર દ્વારા માહિતી અધિકારી અધિનિયમની કલમ ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર) (પી.એ.ડી.) તૈયાર કરવામાં આવી છે અને તા. ૦૧/૦૫/૨૦૨૨ ની સ્થિતિએ તે અઘતન કરવામાં આવેલ છે જેનું અમારા દ્વારા માહે મે/જુન ૨૦૨૨ દરમ્યાન ઈન્સપેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ/અપૂરતી વિગતો માલુમ પડેલ નથી.

૨. તા.૩૦-૬-૨૦૨૧ની સ્થિતિએ હવે મારા કાર્યક્ષેત્રના પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર (P.A.D)નું ઈન્સપેક્શન-કમ-ઓડિટ બાકી રહેલ નથી.

તારીખ:- ૨૭-૦૭-૨૦૨૨

મુખ્ય મથક:- અમદાવાદ

sd/-

(અરૂણ આર. પંડયા)

મ્યુનિસિપલ સેક્રેટરી

મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસ

એનેક્ષર - એ

(સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૧-૦૫-૨૦૦૮ના પરિપત્ર ક્રમાંક:- ૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઈસેલ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી કચેરી મ્યુ. સેક્ટરી ઓફિસ તથા મારા વહીવટી કાર્યક્ષેત્ર દ્વારા માહિતી અધિકારી અધિનિયમની કલમ ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર) (પી.એ.ડી.) તૈયાર કરવામાં આવી છે અને તા. ૧/૫/૨૦૨૨ ની સ્થિતિએ તે અઘતન કરવામાં આવેલ છે જેનું અમારા દ્વારા માહે મે/જુન ૨૦૨૨ દરમ્યાન ઈન્સપેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ/અપૂરતી વિગતો માલુમ પડેલ નથી.

૨. તા.૩૦-૬-૨૦૨૨ની સ્થિતિએ હવે મારા કાર્યક્ષેત્રના પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર (P.A.D)નું ઈન્સપેક્શન-કમ-ઓડિટ બાકી રહેલ નથી.

તારીખ:- ૨૭-૦૭-૨૦૨૨

મુખ્ય મથક:- અમદાવાદ

sd/-

(અરુણ આર. પંડયા)

મ્યુનિસિપલ સેક્ટરી

મ્યુનિસિપલ સેક્ટરી ઓફિસ